



VIDHYAYANA

ISSN 2454-8596

[www.vidhyayanaejournal.org](http://www.vidhyayanaejournal.org)

An International Multidisciplinary Research e-Journal

## ઉના તાલુકાના ધોરણ-૭ના વિદ્યાર્થીઓ પર દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતાનો અભ્યાસ

મોનિકા એચ. ગોસાઈ,  
લેક્ચરર,  
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  
જૂનાગઢ, ગુજરાત.



VIDHYAYANA

ડૉ. હિતેશ એમ. સોલંકી,  
આસીસ્ટન્ટ પ્રોફેસર,  
શ્રીમતી એમ. એમ. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન,  
વદ્વાણ, સુરેન્દ્રનગર, ગુજરાત.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Research e-Journal

### સારાંશ

પ્રસ્તુત સંશોધન ધોરણ—જના વિદ્યાર્થીઓ પર દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતાનો અભ્યાસ કરવાના હેતુથી કરવામાં આવેલ છે. સંશોધનમાં માર્ગદર્શન માટે તમામ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ તરીકે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ—૭ માં વર્ષ ૨૦૧૧–૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લેવામાં આવેલ હતા.<sup>૧</sup> ઉપકરણ તરીકે પ્રમાણિત સિદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં જીસીઈઆરટી—ગાંધીનગર દ્વારા પ્રમાણિત વિષય સિદ્ધિ કસોટીની રચના કરી અને આપવામાં આવી હતી. નમૂના પસંદગીમાં જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં ધોરણ—૭માં અભ્યાસ કરતાં વર્ષ ૨૦૧૧–૧૨ના વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કર્યા હતા જેમાં કુલ ૬ શાળાઓ પસંદ કરી હતી જેમાં કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ હતા. ધોરણ—૭ ના વિદ્યાર્થીઓ માટે દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતા ચકાસવાનું કાર્ય કરવાનું થતું હોય જેના માટે અભ્યાસકે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. પ્રસ્તુત અભ્યાસમાં ઉના તાલુકાની પ્રાથમિક શાળાના ધોરણ—૭માં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતા કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના કુલ ૬૦ વિદ્યાર્થીઓ પાસેથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલ પ્રમાણિત સિદ્ધિ કસોટી દ્વારા વિષય પ્રમાણે કસોટી લઈને માહિતીનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધનમાં ત્રણેય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની સિદ્ધિ કસોટીની મદદથી મેળવેલ પ્રાપ્તાંકો મેળવવા માં આવેલ હતા. આ રીતે મેળવેલ પ્રાપ્તાંકોને કમ્પ્યુટર પ્રોગ્રામ એક્સેલમાં ડેટા ફાઈલ તૈયાર કરીછતી. આ ડેટા પરથી દરેક જૂથ માટે વિવિધ વર્ષનાત્મક અંકશાસ્ત્રીય માપોની ગણતરી કરી હતી. પાત્રોની સંખ્યા, ત્રણેય વિષયમાં મેળવેલ પ્રાપ્તાંકો, સરાસરી, પ્રમાણ વિચલન અને ટી વેલ્યુ શોધવામાં આવી હતી. સંશોધનના મહત્વના તારણોમાં એવું જોવા મળ્યું હતું કે ધોરણ—૭માં ગણિત વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વરચ્યે ચોક્કસ તફાવત જોવા મળ્યો હતો જેમાં દૂરવર્તી શિક્ષણકાર્ય અસરકારક નિવડ્યું હતું જ્યારે વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વરચ્યે ચોક્કસ તફાવત જોવા મળ્યો ન હતો જેમાં દૂરવર્તી શિક્ષણ કાર્ય અને સામાન્ય શિક્ષણ કાર્ય બન્ને સમાન જોવા મળેલ હતું.

### પ્રસ્તાવના

શિક્ષણ સતત ગુણવતા સુધારણા થાય તે માટે ગુજરાત સરકારે દૂરવર્તી શિક્ષણની અધ્યાપન તરેહનો ઉપયોગ કરવાનું વિચાર્યું. જેમાં ટેલિકોન્ફરન્સ દ્વારા ટેકનોલોજીનો મહત્વમાં ઉપયોગ કરીને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયના શિક્ષણને પ્રવૃત્તિમય બનાવી રાજ્યની તમામ પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી સાતના વિદ્યાર્થીઓમાં જે તે વિષયની સંકલ્પનાઓ સ્પષ્ટ કરવાના શુભ આશયથી દૂરવર્તી શિક્ષણનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો. જેના ઘણા મીઠા ફળ પ્રાથમિક શાળાના બાળકોને મળ્યા છે અને શિક્ષણની ગુણવતા સુધરી છે. આ દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમની શિક્ષણ પર કેવી અસર થાય છે તે જાણવાના



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Research e-Journal

હેતુથી પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

સંબંધિત સંશોધનોની સમીક્ષા

પ્રસ્તુત અભ્યાસને સંબંધિત સંશોધનો જુદી જુદી યુનિવર્સિટી કક્ષાએ થઈ ચૂકેલા છે. જેમાંના ચાર સંશોધનોનો સાર અહીં રજૂ કરેલ છે.

સંશોધન વર્ષની રીતે જોઈએ તો આ સંશોધનો જ્યમાણી (૧૯૮૧), રોજ (૧૯૮૨) અને હિરાણી (૨૦૦૩) સંશોધનકર્તાઓ દ્વારા યુનિવર્સિટીમાંથી એમ.એડ.ની પદવી માટે તથા સીગ, આહુવાલીયા અને વર્મા(૧૯૮૧) એ પ્રોજેક્ટવર્કના ભાગ રૂપે સંશોધન હાથ ધરાયા હતા.

પ્રસ્તુત સંશોધનના હેતુઓના સંદર્ભમાં જોઈએ તો સીગ, આહુવાલીયા અને વર્મા(૧૯૮૧) એ ઉચ્ચ માધ્યમિક શાળામાં ગણિત વિષય માટે સીએઆઈની અસરકારકતા પરંપરાગત અધ્યયનના સંદર્ભમાં ચકાસી હતી. જ્યમાણી (૧૯૮૧)એ સીએઆઈ દ્વારા અધ્યાપનના અનુરૂપણ પ્રતિમાનની અસરકારકતા ધોરણ આગિયારનાં ભૌતિક વિજ્ઞાનના વિષય માટે ચકાસી હતી. રોજ (૧૯૮૨)એ નિભન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓના સંદર્ભમાં કમ્પ્યુટર સહાયિત અધ્યયન સોફ્ટવેરની અસરકારકતા ચકાસી હતી. હિરાણી (૨૦૦૩)એ ધોરણ નવનાં વિજ્ઞાન વિષય માટે સીએઆઈ કાર્યક્રમનું નિર્માણ અને તેની અસરકારકતા ચકાસી હતી.

પ્રસ્તુત સંશોધનોના ઉપકરણોના સંદર્ભમાં જોઈએ તો સીગ, આહુવાલીયા અને વર્મા(૧૯૮૧) એ શિક્ષક નિર્મિત સિદ્ધિ કસોટી અને ગણિત વલણ માપદંડ, જ્યમાણી (૧૯૮૧)એ શિક્ષક નિર્મિત સિદ્ધિ કસોટીનો, રોજ (૧૯૮૨) એ શિક્ષક નિર્મિત ખુદ્દિ કસોટીની સાથે પટેલ વાંચન ટેવ સંશોધનિકા અને સુંદર રાજનાની ગણિતીક વલણકસોટીનો, હિરાણી (૨૦૦૩)એ એકમ સિદ્ધિ કસોટી અને અભિપ્રાયાવલિનો ઉપયોગ કર્યો હતો.

પ્રસ્તુત સંશોધનોની સંશોધન પદ્ધતિના સંદર્ભમાં જોઈએ તો જ્યમાણી (૧૯૮૧), રોજ (૧૯૮૨) અને હિરાણી (૨૦૦૩) તથા સીગ, આહુવાલીયા અને વર્મા(૧૯૮૧)એ પ્રાયોગિક પદ્ધતિ નો ઉપયોગ કર્યો હતો.

પ્રસ્તુત સંશોધનોના તારણોના સંદર્ભમાં જોઈએ તો સીગ, આહુવાલીયા અને વર્મા(૧૯૮૧) દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં સીએઆઈ દ્વારા અભ્યાસ કરતા જૂથની સિદ્ધિ સાર્થક રીતે ઉચ્ચી જોવા મળી હતી તેમજ ગણિત વિષય પરનું વલણ વિદ્યાત્મક જોવા મળ્યું હતું. જ્યમાણી (૧૯૮૧) દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં પ્રાયોગિક જૂથના સરેરાશાંકો નિયંત્રિત જૂથના સરેરાશાંકો કરતા ઉચ્ચા હતા. રોજ(૧૯૮૨) દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં કમ્પ્યુટર સહાયિત અધ્યયન, શિક્ષક સાથે અને શિક્ષક વગર પરંપરાગત અધ્યાપન પદ્ધતિ કરતાં વધારે અસરકારક હતું. ઉપરાંત કમ્પ્યુટર સહાયિત અધ્યયન નિભન સિદ્ધિ ધરાવતા બાળકો માટ. સૌથી વધુ અસરકારક પૂરવાર થયું હતું. હિરાણી (૨૦૦૩) દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં શૈક્ષણિક સંદર્ભમાં પરંપરાગત પદ્ધતિ દ્વારા અધ્યાપન કરતા કમ્પ્યુટર એઇડેડ ઈન્સ્ટ્રુક્શન કાર્યક્રમ દ્વારા અધ્યાપન વધારે અસરકારક પૂરવાર થયું હતું.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Research e-Journal

### અભ્યાસના હેતુઓ

પ્રસ્તુત અભ્યાસના હેતુઓ આ પ્રમાણે રચવામાં આવ્યા હતા.

- ધોરણ— ઉના વિદ્યાર્થીઓની સિદ્ધિ પર દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતા ચકાસવી.
- ધોરણ— ઉના ત્રણ વિષયો (વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી) ની સિદ્ધિ જાણવી.
- ધોરણ— ઉના ત્રણોય વિષયોમાં દૂરવર્તી શિક્ષણકાર્યને મેળવતા વિદ્યાર્થીઓની વચ્ચે સાર્થક તફાવતની ચકાસણી કરવી.

### દૂરવર્તી શિક્ષણના હેતુઓ

- ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના વિશિષ્ટ શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય.
- ધોરણ ૫ થી ૭ ના તમામ બાળકોને દૂરવર્તી શિક્ષણના માધ્યમથી વિષયવસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય.
- કઠિન વિષયોના શિક્ષણમાં સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય.
- સારા તજ્જ્ઞ શિક્ષકોનો લાભ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓનેપ્રાપ્ત થાય.
- જુદી જુદી આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય.

### સમસ્યા

ઉના તાલુકાના ધોરણ—ઉના વિદ્યાર્થીઓ પર દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતાનો અભ્યાસ

### ઉત્કલ્પનાઓ

પ્રસ્તુત સંશોધનમાં સંશોધક દારા શૂન્ય ઉત્કલ્પનાઓ રચવામાં આવી હતી જે આ પ્રમાણે છે.

- ધોરણ—ઉના વિજ્ઞાન વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.
- ધોરણ—ઉના ગણિત વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.
- ધોરણ—ઉના અંગ્રેજી વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.

### સંશોધન ક્ષેત્ર

પ્રસ્તુત સંશોધનમાં ધોરણ—૭ ના વિદ્યાર્થીઓ માટે દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતા ચકાસવાનું કાર્ય કરવાનું થતું હોય તો તેથી સંશોધનનું ક્ષેત્ર સર્વેક્ષણ અને શૈક્ષણિક ટેકનોલોજી પ્રકારનું ગણાવી શકાય.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Research e-Journal

### વ્યાપ વિશ્વ અને નમૂનો

પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ તરીકે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૭ માં વર્ષ ૨૦૧૧-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લેવામાં આવેલ હતા.

નમૂના પસંદગીમાં જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં ધોરણ-૭માં અભ્યાસ કરતાં વર્ષ ૨૦૧૧-૧૨ના વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કર્યા હતા જેમાં કુલ ૫ શાળાઓ પસંદ કરી હતી જેમાં કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ હતા.

### ઉપકરણ

પ્રસ્તુત સંશોધનમાં ઉપકરણ તરીકે પ્રમાણિત સિદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં જીસીઈઆરટી-ગાંધીનગર દ્વારા પ્રમાણિત વિષય સિદ્ધિ કસોટીની રથના કરી અને આપવામાં આવી હતી. આ કસોટી દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમની અસરકારતાના અભ્યાસ માટે સિદ્ધિ કસોટી એવું નામ આપવામાં આવેલ જેમાં ધોરણ-૭ના ત્રણ વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી નો સમાવેશ થયો હતો.

### અભ્યાસ પદ્ધતિ

સંશોધનસમયાના પ્રકાર પ્રમાણે સંશોધન પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે. શૈક્ષણિક સંશોધનોમાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. શૈક્ષણિક સંશોધનોમાં સામાન્ય રીતે પ્રાયોગિક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ, સંબંધાત્મક પદ્ધતિ અને વિકાસાત્મક અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે.

ધોરણ-૭ ના વિદ્યાર્થીઓ માટે દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતા ચકાસવાનું કાર્ય કરવાનું થતું હોય જેના માટે અભ્યાસકે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

### માહિતી એકત્રીકરણ



VIDHYAYANA

પ્રસ્તુત અભ્યાસમાં પ્રયોજક દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ માં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાના ધોરણ-૭માં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતા કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના કુલ ૬૦ વિદ્યાર્થીઓ પાસેથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલ પ્રમાણિત સિદ્ધિ કસોટી દ્વારા વિષય પ્રમાણે કસોટી લઈને માહિતીનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

### માહિતી પૃથક્કરણની રીત

પ્રસ્તુત સંશોધનમાં ત્રણેય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની સિદ્ધિ કસોટીની મદદથી મેળવેલ પ્રાપ્તાંકો મેળવવા માં આવેલ હતા. આ રીતે મેળવેલ પ્રાપ્તાંકોને કમ્પ્યુટર પ્રોગ્રામ એક્સેલમાં ડેટા ફાઈલ તૈયાર કરીછુટી. આ ડેટા પરથી દરેક જૂથ માટે વિવિધ વર્ણાત્મક અંકશાસ્ત્રીય માપોની ગણાતરી કરી હતી. પાત્રોની સંખ્યા, ત્રણેય વિષયમાં મેળવેલ પ્રાપ્તાંકો, સરાસરી, પ્રમાણ વિચલન અને ટી વેલ્ફ્યુ શોધવામાં આવી હતી. ટી-ટેસ્ટ માટે સાર્થકતાની કિમત ૦.૦૧ કક્ષાએ ૨.૫૮ અને ૦.૦૫ કક્ષાએ ૧.૮૬ હતી.



VIDHYAYANA

ISSN 2454-8596

www.vidhyayanaejournal.org

## An International Multidisciplinary Research e-Journal

### માહિતી પૂછકકરણ અને અર્થઘટન

પ્રસ્તુત સંશોધનમાં શૂન્ય ઉત્કલ્પનાની રચના કરવામાં આવી હતી અને તેના આધારે અંકશાસ્ત્રીય ગણતરી કરવામાં આવી હતી. તેની સાર્થકતાની કક્ષા 0.01 અને 0.04 કક્ષાએ ચકાસવામાં આવેલ હતી.

**ઉત્કલ્પના: ૧** ધોરણ-૭ના વિજ્ઞાન વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.

### સારણી-૧

દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચના તફાવતની સાર્થકતા

ક્રમ	જીથ	સંખ્યા	સરાસરી	પ્રમાણ વિચલન	ટી મૂલ્ય	સાર્થકતાની કક્ષા
૧	દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતું જીથ	૬૦	૬૨.૦૦	૨૫.૫૦	૦.૪૫	સાર્થક નથી
૨	દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતું જીથ	૬૦	૬૦.૨૫	૧૬.૪૫		

**ઉત્કલ્પના: ૨** ધોરણ-૭ના ગણિત વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચના તફાવતની સાર્થકતા

### સારણી-૨

દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચના તફાવતની સાર્થકતા

ક્રમ	જીથ	સંખ્યા	સરાસરી	પ્રમાણ વિચલન	ટી મૂલ્ય	સાર્થકતાની કક્ષા
૧	દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતું જીથ	૬૦	૫૮.૫૦	૨૭.૧૫	૪.૬૬	૦.૦૧
૨	દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતું જીથ	૬૦	૭૮.૬૨	૧૩.૬૫		

**ઉત્કલ્પના: ૩** ધોરણ-૭ના અંગ્રેજી વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચના તફાવતની સાર્થકતા

### સારણી-૩

દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચના તફાવતની સાર્થકતા

ક્રમ	જીથ	સંખ્યા	સરાસરી	પ્રમાણ વિચલન	ટી મૂલ્ય	સાર્થકતાની કક્ષા
૧	દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતું જીથ	૬૦	૬૦.૩૭	૨૬.૭૫	૦.૭૪	સાર્થક નથી
૨	દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતું જીથ	૬૦	૫૭.૨૫	૧૭.૮૦		

### તારણો



VIDHYAYANA

ISSN 2454-8596

[www.vidhyayanaejournal.org](http://www.vidhyayanaejournal.org)

## An International Multidisciplinary Research e-Journal

- ધોરણ-૭માં ગણિત વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વર્ચ્યે ચોક્કસ તફાવત જોવા મળ્યો હતો જેમાં દૂરવર્તી શિક્ષણકાર્ય અસરકારક નિવડ્યું હતું.
- ધોરણ-૭માં વિજ્ઞાન વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વર્ચ્યે ચોક્કસ તફાવત જોવા મળ્યો ન હતો જેમાં દૂરવર્તી શિક્ષણ કાર્ય અને સામાન્ય શિક્ષણ કાર્ય બન્નો સમાન જોવા મળેલ હતું.
- ધોરણ-૭માં અંગ્રેજી વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વર્ચ્યે ચોક્કસ તફાવત જોવા મળ્યો ન હતો જેમાં દૂરવર્તી શિક્ષણ કાર્ય અને સામાન્ય શિક્ષણ કાર્ય બન્નો સમાન જોવા મળેલ હતું.

સમગ્ર સંશોધન પર ટૂટિ કરતાં માલૂમ પડે છે કે એકંદરે દૂરવર્તી શિક્ષણ કાર્ય અનેસામાન્ય શિક્ષણ કાર્ય બન્નો સમાન જોવા મળેલ હતું.

### શૈક્ષણિક ફિલીતાર્થ

- વિજ્ઞાન જેવી પ્રાયોગિક વિષયવસ્તુ દૂરવર્તી શિક્ષણ કાર્ય દ્વારા જ શીખવવી જોઈએ.
- ગણિત અધરી રીતોમાં દૂરવર્તી શિક્ષણ કાર્યની મદદ લેવી જોઈએ.
- અંગ્રેજી વિષયમાં પણ વ્યાકરણ જેવા અધરા મુદ્દાઓ દૂરવર્તી શિક્ષણ કાર્ય દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
- તમામ શાળાઓ દૂરવર્તી શિક્ષણ કાર્યની મદદથી શિક્ષણ કાર્ય કરાવે તો બાળકોને નાવિન્યતાનો લાભ મળે.
- રાજ્યકક્ષાના તજ્જ્ઞ શિક્ષકોના લાભ તથા ટેકનોલોજીના ઉપયોગની જાગૃતતા વધે તેથી દૂરવર્તી કાર્ય ઉત્તમ ગણાય .



VIDHYAYANA

ISSN 2454-8596

[www.vidhyayanaejournal.org](http://www.vidhyayanaejournal.org)

## An International Multidisciplinary Research e-Journal

### સંદર્ભ સૂચિ

ડાયેટ (૨૦૦૫). સી. આર. સી. કક્ષાએ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન – ૨૦૦૫–૦૬. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ.

વ્યાસ, એમ. (૨૦૦૫). કમ્પ્યુટર સહાયિત પરીક્ષણ કાર્યક્રમની સંરચના અને અજમાયશ. અપ્રકાશિત એમ. એડ. લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શિક્ષણશાસ્ત્ર ભવન, રાજકોટ.

Bhutak,(2004). Development And Try-out of Computer Aided Language Learning (CALL) Package for Teaching of Action Verbs in English Language. Unpublished Dissertation, Saurashtra University, Rajkot.

Dangar, B. G. (2003). Development and Effectiveness of Computer Aided Instruction (CAI) Programme for Teaching Subject English at Primary Level (Guj.). Unpublished Dissertation, Saurashtra University, Rajkot.

Hirani, |T. R. (2003). Development and Effectiveness of Computer Aided Instruction (CAI) Programme in Teaching Subject Science of Secondary School Level 9Guj.). Unpublished Dissertation, Saurashtra University, Rajkot.

પાથેય(૨૦૧૧–૧૨). ગાંધીનગર: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

શાહ ડી.બી. (૨૦૦૪). શૈક્ષણિક ઔર અનુસંધાન. દિલ્હી: મેકમિલન કંપની ઓફ ઇન્ડીયા લિમિટેડ.

ઉચાટ.ડી.ઓ. (૨૦૦૯). શિક્ષણ અને સામાજિક વિજાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. રાજકોટ: નિજિજન સાયકો સેન્ટર.

VIDHYAYANA